

ગાંડપણ મગજના વક્રિઓ નું ક સામન્ય શબ્દ છે, જે ગંભીરતથી ક વચક તની એજની પ થૂત કથવા મટે પ થમવતિકહે છે. વથિ 6 લોકોમં Alzheimer નો યેગ ગાંડપણનો સૌથી સાધથ પ કથ છે. આ મગજને નચિત થતિકથવા મટે વચિ, ચાદશક ત અને ભધાના કેટલાક ભગોનો સમવેશ છે. Alzheimerના યેગના કથથો હજી સુધી અજાણયા છે અને તેનો કોઇ ઇલાજ નથી. આ યેગ સાધથ પછે ૬૦ વથ ધની ઉમ્ પછી શૂ થય છે અને ઉમ્ની સાથેતે જોખ વધુજાય છે. વૈજ જાનકિ આ પણ શોધી કાટુ છે કે Alzheimerના યેગવાળા લોકોના મગજમં ઊજા ફેક્ટ થય છે. મગજના ભગોમં મજ જંતુમા કોધોનુ નુકશાન થય છે, જે ચાદશક ત અને ઊજી મનસકિ આવડતમટે આવશક છે અને મગજમં થસાયણકિ ના છા સ છે, જે જટલિ સંદેશા મજ જંતુમા કોધોની આગળ અને પાછળ લઈ જાય છે. Alzheimer નો યેગ કદાર સામન્ય વચિ અને ચાદશક તને જુદા પાડે છે અને સંદેશાને મજ જંતુમા કોધોની વરે વધિ ન લાવે છે.

Alzheimer નો રોગ શું છે?

Alzheimer ઈથી શૂ થય છે. સૌથી પહેલા ફક તલક ધણો કદાર હલકુ ભલકણાપણુ, તજેતથમં પ્નેલી ઘટનાને ચાદ થખવા થી મુશકેલી, પ થૂત અથમા પથચિતલોકોના નામ અથમા વસતુને ચાદ થખવા મુશકેલી થય છે. સાદી ગણીત્તી સમસ્યાનો જવાબ આપવામં મુશકેલી થય છે. આ ત થસદાયક થઈ જાય છે, પણ સામન્યત આ ગંભીર વેત્તણીનુ કથથ નથી.

આ ફક ત ક યેગ જ ચાથે ઈથી આગળ વધીને વધે ળગડી જાય છે અને વધે સથાતથી તેમા લક ધણો નજથમં આવે છે, ત ચાથે ચકિતિ સા મટે મદ ગંભીર થઈ જાય છે. Alzheimerના યેગની સાથેમા લોકો તેમા છેલ લા સ્થળમં કદાર સથા કામ કેવી થીતકથુ તેપણ ભૂલી જાય છે, જેવુ કે દાતસાફ કથવા અથમા વાળ ળવા. તે હવે સ પ ધ ટ થીતવચિથી શકત નથી. બેલવામં, સમજવામં, વાંચવામં અથમા લખવામં ઠલીક થય છે. ત ચાથે પછી Alzheimerના યેગવાળા લોકો કદાર વધે અસ વસ થ અથમા આક થક થઈ જાય છે અથમા ઘથી દુઃ ભટકી જાય છે. છેવટે દથી ની દેખભળ અને ધ્યાન થખવાની જૂથ છે.

ક વ હેલા બેબે થીતકથેલુ Alzheimerના યેગનુ નદિાન દથી અને તેમા કુંટુંને ભવિ યમં યોજના પ્નાવવા મદ કથે છે. આ તેને દેખભળના વકિલ પ ઉપચ થ કથવા મટે સમ્ય આપે છે, જ ચાથે દથી હજી પણ નથિ ણય લેવા મટે ભગ લઈ શકે છે. વ હેલુ નદિાન પણ યેગના લક ધણોનો ઉપચ કથવા સૌથી સાથી ઠ આપે છે. ડ કટથે "સંભવિત" અથમા "પ્નવાજોગ" Alzheimerના યેગના વચિ ટ કેન ઠ થે ઉપચ કેટલીક પ થક થયા ના મધી યથી ક નદિાન કથે છે. ક સંપુથ ણ વૈદ ચકીય ઇતહાસ વ ચક તના સામન્ય સ વાસ ય, પહેલાની વૈદ ચકીય સમસ્યા, એજની પ થૂત કથવા દથ્યાન આવતે ઠલીક વચિની જાણકથીનો સમવેશ છે. વૈદ ચકીય સ્કાસણી જેવી કે લોહી, પેશાબ અથમા કથેડના પ થવાહીની સ્કાસણી. મનસકિતને સંધતિમગજની તમાસણી - સ મથાશક ત, સમસ્યાનો ઉકેલ, ધ્યાન, ગણતી અને ભધાનુ પથમિણ કથે છે. મગજનુ પૃથક કથથ જોવા મટે કે તેમં કોઇ અસાધથાત છે. ડ કટ ઊજા સંભવિતકથથો ક વ ચક તના લક ધણો, તેનો વૈદ ચકીય ઇતહાસ અને સ્કાસણીના પથણામ સ્ખતલ કથે છે. ઉદાહથથ મટે કંઠગ થીની સમસ્યા, દવાની પ થકિ થયા, ઉદાસનિત, મગજમં ગુમ્ડુ અને મગજમં લોહીની વાહનીનો યેગ, Alzheimerના યેગ જેવા લક ધણોનુ કથથ પ્ને છે. ઊજા લક ધણોનો પણ સકળતથી ઉપચ થઈ શકે છે. Alzheimer ક પ ઘાતશીલ ઊમથી છે, લક ધણો સમ્યની સાથેવધે ખથબ થઈ જાય છે. તે છત તે પથવિથ ત્મશલિ યેગ પણ છે. લક ધણો જુદાજુદા દથ ઉપચ અને જુદીજુદી જાતપ થણે પ ઘાતકથે છે. ઉપસ થિ અને લક ધણોની પ ઘાતઆગળના દથેક વ ચક તમટે ખલતે થથે છે.

Alzheimer નો રોગ શું છે? (સંભવિત કારણો)

- ચિ, વહેમ, શક કીપણુ, આંદોલન.
- વ ચક તિ વ અને નથિ ણય લેવામં પથવિથ ત્મ.
- ગૂંચડો અને સ મથાશક તની હાનિ.
- એજના જીવન મટે પ થૂત મં મુશકેલી, જેવી કે ખવડાવવુ અને નાહવુ.
- કુંટું અને મિ થેને ળખવામં મુશકેલી.
- આત મ્વસિ મ્ત.
- પથચિતવાતવથથમં ખોવાઈ જવુ.
- મ્તિ અ અને ભ થથા.
- ભુખ નહી લાગવી.
- વજનમં કમી.
- મ્તી થશાય અને આત્ડાની હાનિ.
- ભધણની હાનિ.

- નચિમતિકાથોની સાથે સમ્પત્તિયા .
- બેલવાનુ અથ્થા પ ક થિાનુ પુનથવથ ત્ત.
- નદિ થમં અશાંતી.
- દેખભળ થખવાવાળા ઉપથ સંપુથ ઇ નથિ ભ્થ.
- થમડવુ, આગળ પાછળ ચલવુ.